



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૪/૦૬/૨૦૧૯ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૬૯/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૫૫ કેસ કરી, ૫૨ વ્યક્તિઓને ઝડપી, ૨૨૯ લીટર દેશી દારૂ, ૩૬૬ બોટલ ઈંગ્લીશ દારૂ, ૧૮ બીયરટીન, ૦૧ કાર અને ૧ સ્ફટક કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૦૯ કેસ કરી ૫૧ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૬૧,૭૭૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૭૦/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૨૦ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૦૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૧૦૭૧/૧૯

વસ્ત્રાપુર : વિનયભાઈ જ્ઞાનચંદભાઈ જૈન (ઉ.વ.૫૦)(રહે, સનરાઈઝ પાર્ક, ડ્રાઈવ-ઈન સિનેમાની સામે, થલતેજ) એ તા.૨૩/૬/૧૯ નારોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૮/૧૧/૨૦૧૮ થી તા.૦૭/૦૨/૨૦૧૯ સુધીના સમયગાળા દરમિયાન રાજપથ ક્લબની પાછળ આવેલ સંકલ્પ કોર્પોરેટ હાઉસ ખાતે આરોપી એન.સીનીવાસન ("જી.કે.એન એન્ટરપ્રાઈઝ" કંપનીના માલિક ઓફીસ : બીજો માળ, પ્લોટ નં ૩૧૩ વોર્ડ નં ૧૨/બી સ્ક્વેર એપાર્ટમેન્ટ, ડોમીનોઝ પીઝાની સામે, ગાંધીધામ પુર્વ કચ્છ) નાએ વિનયભાઈની કંપનીના નામનો પર્યેઝ ઓર્ડરનો ઈમેલ તેમના મિત્રના મેઇલ ઉપર એક હજાર બેરલ્સનો ઓર્ડર મોકલી આપી, જે મેઇલ વિનયભાઈને ફોરવર્ડ કરી, વિનયભાઈને વિશ્વાસમા લઈ તા.૦૪/૧૨/૧૮ ના રોજ એક હજાર બેરલ્સ તથા તા.૧૭/૧૨/૧૮ ના રોજ બે હજાર બેરલ્સનો પર્યેઝ ઓર્ડર મળી કુલ ચાર હજાર બેરલ્સ કુલ કિંમત રૂપિયા ૬૫,૭૫,૨૫૫/- મતાનો માલ અલગ-અલગ તારીખે તેઓની (ગાંધીધામ ફેક્ટરી-૩૦૬, નર્મદા એસ.ડી.એફ કોમ્પ્લેક્સ, ફેઝ -૨ કંડલા સ્પેશીયલ ઈકોનોમીક ઝોન ગાંધીધામ) ખાતે મોકલી આપેલ હોવા છતા આજદિન સુધી માલની કોઈ ચૂકવણી નહીં કરી, વિનયભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જી.આર.ભરવાડ ચલાવે છે.

નરોડા : મહેશભાઈ ઉર્ફે બોડો દેવાભાઈ ભરવાડ (રહે. ભરવાડ વાસ, સીટી કોર્નર પાસે, નરોડા ગામ) એ તા.૨૩/૬/૧૯ નારોજ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે એક વર્ષ પહેલાં તથા તા.૮/૧૨/૨૦૧૮ તથા તા.૧૮/૬/૧૯ થી આજદિન સુધીના સમયગાળા દરમ્યાન મહેશભાઈના ઘરે તથા નરોડા જે.પી કોમ્પ્લેક્સ પાસે આરોપી (૧) ધ્રુવ દિપકભાઈ જાની અને (૨) અલકાબેન દિપકભાઈ જાની (રહે. સાર્થક ડુપ્લેક્સ માધવ ગાર્ડનની સામે પાયલનગર નરોડા) એ ભેગામળી “તેઓના ઘરે સામાજીક પ્રસંગ હોઇ પ્રસંગમાં પહેરવા દાગીનાની જરૂરીયાત હોય” તેમ કહી મહેશભાઈ ને વિશ્વાસમાં લઇ, તેમના સોનાના દાગીના કુલ ૭૦ તોલા વજનના કુલ કિંમત રૂપિયા ૧૮,૦૦,૦૦૦/- મતાના લઇ જઇ, તે સોનાના દાગીના અલંકાર જવેલર્સ નરોડા ખાતે ગીરવે મુકી તેના પૈસા મેળવી લઇ, દાગીના પરત નહીં કરી તેમજ તે પેટે કોઇ રૂપિયા નહીં ચુકવી મહેશભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એ.એમ.પટેલ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૦૭૨/૧૯

વટવા : આકાશભાઈ અનીલભાઈ પટેલ (પટણી)(ઉ.વ.૨૧)(રહે.રેલ્વે સ્ટેશન સામે ચાર માળીયા વટવા) એ અગમ્ય કારણસર તા.૨૩/૦૬/૧૯ ના કલાક ૧૨/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરના રસોડાના સિલીંગ માં લગાવેલ પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. આ અંગે વટવા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી યુવરાજસિંહ શીવુભા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.